

BUSINESS મિત્ર Plus

અમેરિકામાં ફુગાવો વકરતા બુધવારે ફેડની બેઠકમાં રેટ હાઈક લગભગ નક્કી?

દૈનિક બજારોમાં કુડમાં નવેસરથી સ્ફોટક તેજ થઈ જતા અને અલ નીનોના ઓછાયા વચ્ચે અનાજ ઉત્પાદનની ચિંતાઓ વધતા શેરબજારોમાં માનસ નરમ થઈ ગયું છે. ફોરેક્સ રિઝર્વ 785 અબજ ડોલર જેવી ઓલટાઈમ હાઈ થઈ ગઈ છે, પણ રૂપિયાને એનો ખાસ લાભ મળ્યો નથી. કરન્સી બજારને લોકલ મેક્રો ડેટા કરતા કુડની તેજ- ઈરાન-યુક્રેન યુધ્ધ, અલ નીનો જેવા બાહ્ય પરિબળોની વધારે ચિંતા લાગે છે. એનર્જી બજારોની વાત કરીએ તો બ્રેન્ટ કુડ ઓઈલ 109 અને નાયમેક્સ કુડ 104 ડોલર થઈ ગયું છે. એમસીએસ કુડ વાયદો 9890 જેવો થઈ ગયો છે. ગલ્ફમાં હુશીઓએ યેમેનનું મોથા બંદર કબજે કરીને બાબ અલ મેન્ડેબ ચોકપોઈન્ટ પર પોતાની પોઝિશન મજબૂત બનાવતા હવે હોરમુઝ અને બેલ્ક સી સાથોસાથ રેડ સી- બાબ અલ મેન્ડેબનો નવો મોરચો ખૂલ્યો છે. હુશી બળવાખોરોએ સાઉદી ટેન્કરો તેમજ પાઈપલાઈન પર એટેક કર્યા પછી કુડમાં ઉછળી આવ્યો છે. ચીન-મીડલ ઈસ્ટ વચ્ચે સુપર ટેન્કના


જહાજ ભાડાના લાખ ડોલર પહોંચ્યા છે. હાલના ભાવે એક બેરલ કુડ પર 15 ડોલર ખર્ચ તો નૂરભાડાનો લાગે. કુડની સ્ફોટક તેજમાં ડિઝલની રોકેટગામી તેજ દબાઈ ગઈ છે. અમેરિકામાં ડિઝલ 6 ડોલર પર ગેલન અને યુરોપમાં ડિઝલ 1425 ડોલર પર ટન થઈ ગયું છે. યુરોપમાં ડિઝલને ટનમાંથી ડોલરમાં કનવર્ટ કરીએ તો

તો નિકટી ધીમા ઘસારા સાથે 23398 બંધ હતો. અંદાજે બે વરસથી નિકટી અને સેન્સેકસમાં ધીમો ઘસારો છે. વાયદા અને ઓપશન બજારમાં નવી ઓકશન સિસ્ટમ આવ્યા પછી વોલ્યુમ તળીયે ગયા છે. કેશ સેગમેન્ટમાં પણ ધીમો ઘસારો છે. વિદેશી રોકાણકારો ભારતમાંથી એકપોઝર ઓછુ કરી જાપાન-કોરિયા-તાઈવાન જેવા

અલનીનો- અખાતનો તનાવ વધતા કુડ અને કુડના ટ્રિપલ શોકનો ખતરો વધ્યો

190 ડોલર આસપાસ ભાવ થાય. વૈશ્વિક સ્તરે અલ નીનો મજબૂત બનવાના સંકેતો છે. ફેબ્રુઆરી સુધી અલ નીનો મજબૂત રહેવાની આગાહીઓ છે. હાલમાં ઈન્ડોનેશિયામાં જંગલોની આગ- યુરોપમાં હીટવેવ, ચીનમાં પુર- ભારતમાં અનિયમત ચોમાસુ એમ વૈશ્વિક અર્થતંત્ર મોઢવારીના મોરચે એનર્જી શોક અને કુડ શોક એમ બેવડો પડકાર છે. સ્થાનિક શેરબજારોની વાત કરીએ

ટેકનોલોજી બજારો એઆઈ- મેમરી લીડર બજારોમાં દોડ્યા છે. ભારતીય શેરોમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 17 વરસના નીચા સ્તરે પહોંચ્યો છે. વિશ્વ બજારી વત કરીએ તો અમેરિકામાં પીપીઆઈ અને સીપીઆઈ ડેટા અપેક્ષા કરતા ઘણો મજબૂત આવતા સોનાચાંદી અને બોન્ડ બજારોમાં ભારે મોટી વધઘટ આવી હતી. સોનામાં ઈન્ડૂઝે 100 ડોલરની અફઝાતફડી હતી. 10 વરસના બોન્ડ



યિલ્ડ 15 વરસના હાઈ પર પાંચ ટકા પહોંચ્યા છે. 30 વરસના બોન્ડ યિલ્ડ 5.40 ટકા થયા હતા જે 22 વરસની ઊંચી સપાટી છે. બુધવારે ફેડની બેઠકમાં વ્યાજદર વધવાની શક્યતા 69 ટકા થી વધીને 89 ટકા થઈ ગઈ છે. પીપીઆઈ- જથ્થાબંધ ભાવાંક 4.8 સામે વધીને 5.4 ટકા આવ્યો છે,

સીપીઆઈ- વપરાશી ભાવાંક 0.1 ટકા વધી 3.4 ટકા હતો પીપીઆઈ અને સીપીઆઈ વચ્ચેનો ગેપ બે ટકા જેવો મોટો થઈ ગયો છે એ જોતા ફેડ માટે કશમકશ છે. ફેડ વ્યાજદર વધારો ટાળે તો એમના પર રાજકીય દબાવે એવું દેખાય, ફેડિબીલિટી પર અસર થાય સરવાળે ડોલર માટે નેગેટિવ ગણાય.

રેટ હાઈક આવે તો ટ્રમ્પની નારાજ આવે છે કે નહીં એ જોવાનું રસપ્રદ રહેશે. ઈસીબી-યુરોપે રેટ વધાર્યા છે. એટલે ફેડ ચેરમેન કેવિન વોર્શે પણ વ્યાજદર વધારી ફુગાવો નાથવા પોતાના શબ્દોને એકશનથી ટેકો આપવો પડે. સોનાચાંદીની વાત કરીએ તો

ફુગાવાના ડેટા પછી સોનાચાંદીમાં ક્ષણિક મોટો કડાકો આવ્યો હતો પણ તરત બજારો બાઉન્સબેક થયા હતા. સોનાચાંદી અને બીટકોઈનમાં ફરી રિસ્ક પ્રિમિયમ બીજ અપ થવા લાગ્યું છે. લંડન સોનું 4000 ડોલર આસપાસ બોટમઆઉટ થઈને હાલ 4350 ડોલર છે. ચાંદી 55 ડોલર આસપાસ બોટમ આઉટ થઈ હાલ 64 ડોલર છે. મીડ ટર્મ ચૂંટણી પતે નહીં ત્યા સુધી બે

બીરેન વડીલ
તરફી મોટી વધઘટ આવતી રહે એ શક્ય છે. સોનાની રેન્જ 3900-5200 ડોલર, એમસીએક્સ સોનાની રેન્જ 140000-170000 દેખાય છે. ચાંદીમાં 58-60 ડોલર સપોર્ટ ઝોન અને 73-76 રેઝિસ્ટન્સ ઝોન છે. બેઝ મેટલ્સમાં એકદરે તેજ છે. ટેરિક અને ચાઈનાના મેક્રો ડેટા ક્યારેક ક્યારેક તીવ્ર કરેક્શન આપે છે એઆઈ-ઈવી- એનર્જી ટ્રાન્જીશન સેક્ટરનો વિકાસ જોતા લાંબા ગાળે કોપર-ઝિંક- ટીનમાં મજબૂત માગ રહેશે. એમસીએક્સ કોપરમાં રેન્જ 1348-1442, ઝિંક 393-429,

એલ્યુ 342-362, કુડ 8500-10400 ગણાય. બીટકોઈન 60000થી 82000 સુધીનો ઉછળો શમ્યો છે, બીટકોઈન 80000થી થટી 76500 ડોલર જેવો કરેક્શનમાં છે. એઝીબજારોમાં અલ નીનો મજબૂત બનવાની આગાહીઓ વચ્ચે એરંડા-ગવાર-હળદરમાં ઉછળી આવ્યો છે. એમપી- મહારાષ્ટ્રમાં ચોમાસુ સક્રિય થતા સોયાબીનમાં ઉછળે વેચવાલી છે. રાયડાપોળ-એરંડાપોળમાં મકકમ તેજ છે. પાદ્યતેલોમાં ઉંચા મથાળે ઘરડીનો વસવસો છે. હાલમાં સાઉથ-વેસ્ટમાં વરસાદની ખાધ, પૂર્વભારતમાં એક્સેસ આમ વિસંગતીઓ ઘણી છે. હાલમાં મગફળી- કપાસ અને કેટલાક વિસ્તારોમાં કપાસને પાણીની જરૂર છે. એરંડાના વાવેતરો થોડા લેટ છે, કચ્છ- રાજસ્થાન, ઉ ગુજરાતમાં વરસાદ બંધાતા, મહા-કણાટકમાં વરસાદની અનિયમતાથી સોયાબીન-તુવરને પણ પાણીની તાતી જરૂર છે. અનાજ- કઠોળ-મકાઈ આગામી દિવસોમાં ફોક્સમાં રહેશે. કેટલફીડ બજારોમાં પણ અંડરટોન તેજનો છે.

ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર પરંપરાગત નહીં, પણ ટેકનોલોજી અને વ્યૂહાત્મક તરફ આગળ વધશે

ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર હવે માત્ર પરંપરાગત ઉત્પાદન પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ઝડપથી ટેકનોલોજી અને વ્યૂહાત્મક સેક્ટર્સ તરફ આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ભાગને પહોંચી વળવા માટે ઔદ્યોગિક ઉત્પાદન વધારવા ઉપર ફોકસ કરાઈ રહ્યું છે અને આ સેક્ટરમાં નવા સ્ટાર્ટઅપ્સ પ્રવેશી રહ્યા છે. આમ, સ્થાનિક ઉત્પાદન અને મોબાઈલ ઘટકો, સોલાર અને એરોસ્પેસ જેવા સેક્ટરોમાં સ્થાનિકીકરણ દ્વારા વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત થવાની અપેક્ષા છે. વૈશ્વિક બ્રોકરેજ હાઉસ જેફરીએ ભારત ઉપર રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતમાં નવી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ છે. સ્પેસ, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર સહિતના છ સેક્ટર ભારતીય અર્થતંત્રનું ચિત્ર બદલી શકે છે. જેફરીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, 2030 સુધીમાં સ્પેસ ઈકોનોમી આજની તુલનામાં 5 ગણી થઈ જશે. 2030 સુધીમાં છ સેક્ટરમાં મોટી તેજ આવશે. તેમને સરકારી નીતિઓનો બુસ્ટર ડોઝ મળશે. આ ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રનો પ્રવેશ ગેમ ચેન્જર સાબિત થશે, સ્થાનિક ઉત્પાદનથી ફાયદો થશે.



થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટ્રીમ (ઈસીએમએસ) હેઠળ, મોબાઈલ ઘટકોના કુલ મૂલ્યનો સ્થાનિક હિસ્સો અથવા બિલ ઓફ મટિરિયલ્સ આગામી છથી સાત વર્ષમાં લગભગ 50 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. હાલમાં તેનો

પીસીબી મેન્યુફેક્ચરિંગ વધારવાની મોટી સંભાવના છે. રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોલાર પીવી ઉત્પાદક બની ગયો છે. દેશમાં

અને પ્રોડક્શન-લિંકડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાઓ સોલર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં સંકલિત ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. આ પગલાં સેલ, વેફર્સ

વૈશ્વિક સ્તરે મોબાઈલથી લઈને સોલારથી એરોસ્પેસ સુધી ભારત હરણાફાળ ભરશે, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા, નવીનતા અને વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાઓ સાથે ભારતના એકીકરણમાં વધારો થવાની અપેક્ષા છે

પહેલેથી જ લગભગ 35 ગીગાવોટની સોલાર સેલ ઉત્પાદન ક્ષમતા છે, જ્યારે લગભગ 100 ગીગાવોટ ક્ષમતા નિર્માણાધીન છે. સરકારની મંજૂર સુધિ ઓફ મોડલ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ (એલએમએમ), ડોમેસ્ટિક મટિરિયલ રિકવાયરિસ

અને ઈંપોર્ટ્સના ક્ષેત્રમાં બેકવર્ડ ઈન્ટિગ્રેશનને પણ પ્રોત્સાહિત કરે છે. ભારત 2030 સુધીમાં સ્થાનિક સ્તરે સોલર ઉત્પાદનની લગભગ 90 ટકા મૂલ્ય શ્રૃંખલા વિકસાવશે તેવી અપેક્ષા છે. એરોસ્પેસ ક્ષેત્રમાં વૈશ્વિક માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ભારત માટે

ભારતના ઔદ્યોગિક વિકાસના આગામી તબક્કામાં સનરાઈઝ ઈન્ડસ્ટ્રીઝની ભૂમિકાને મજબૂત કરી રહ્યું છે. તે જ સમયે, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા, નવીનતા અને વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાઓ સાથે ભારતના એકીકરણમાં વધારો થવાની અપેક્ષા છે.

ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના ઘટકો માટે ભારતની ચીન પરની નિર્ભરતા વધી છે

હિન્ડી ક્સ શિખર સંમેલન પહેલાં જાહેર થયેલા નવા અભ્યાસ મુજબ, વર્ષ ૨૦૨૫-૨૬માં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ૭૧ પ્રોડક્ટ લાઈન્સમાં ભારતે કરેલી કુલ આયાતમાંથી ઓછામાં ઓછો ૮૦ ટકા હિસ્સો ચીનનો હતો. આ નિર્ભરતા ફિનિશ ગુડ્સ (તૈયાર વસ્તુઓ) કરતાં મોટર, કેબલ્સ અને સ્વિચિંગ ઈલેક્ટ્રોનિક્સ જેવા મુખ્ય ઘટકો (કોમ્પોનન્ટ્સ) પર વધુ કેન્દ્રિત છે. અભ્યાસમાં જણાવા મળ્યું છે કે આયાતમાં જાણવા મળ્યું છે કે આવી પ્રોડક્ટ લાઈન્સની સંખ્યા ૨૦૧૮-૧૯માં ૪૪ હતી, જે વધીને

સ્તરે ઝીણવટભર્યું વિશ્લેષણ કરે છે. હાર્મોનાઈઝ સિસ્ટમ (HS) એ વેપારી માલસામાનના વર્ગીકરણ માટે વપરાતો આંતરરાષ્ટ્રીય ધોરણનો કોડ છે. HS ચેપ્ટર ૮૫ માં ઈલેક્ટ્રિકલ મશીનરી અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો સમાવેશ થાય છે. જે ૭૧ પ્રોડક્ટ લાઈન્સમાં ચીનનો આયાત હિસ્સો ઓછામાં ઓછો ૮૦ ટકા હતો, તેમાંથી ૪૬ લાઈન્સે ૨૦૧૮-૧૯ પછી જ આ મર્યાદા પાર કરી છે. આ દર્શાવે છે કે સમય જતાં ચીન પર ભારતની આયાત નિર્ભરતા વધી છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે,



છે. અહેવાલમાં આ અસંતુલનને લાંબા ગાળાનું ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં ઉમેરાયું છે કે, “ચીન સાથે ભારતની વેપાર ખાધ સાયકલિકલ સાથે ચીન ખાતે ભારતનું સૌથી મોટું નિકાસ ચેપ્ટર છે, પરંતુ આ આંકડો તે જ કેટેગરીમાં થતી આયાતની સરખામણીમાં ખૂબ નાનો છે. લિથિયમ-આયન બેટરીઓ એક મુખ્ય ચિંતાજનક ક્ષેત્ર તરીકે ઊભરી આવી છે. ચીનમાંથી ભારતની આયાત ૨૦૨૧-૨૨થી બમણી થઈને ૩.૯ અબજ ડોલર થઈ ગઈ છે, જેમાં ચીનનો હિસ્સો વધીને ૮૩.૬ ટકા થયો છે અને ૨૦૨૫-૨૬માં પ્રથમ વખત ૮૦ ટકા નિર્ભરતાની મર્યાદા વટાવી ગયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, “આ તીવ્ર વધારો દર્શાવે છે કે લિથિયમ-આયન બેટરીઓ ભારતની ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક મોબિલિટી ઈકોસિસ્ટમ માટે સતત આયાત નિર્ભરતાથી હટીને સ્થાનિક રીતે મજબૂત ઉત્પાદન ક્ષમતા તરફ આગળ વધવાનો હોવો જોઈએ.” અભ્યાસમાં એ પણ જણાવવા મળ્યું

છે કે ચીને ભારતની સેમિકન્ડક્ટર આયાતમાં ૪૮.૯ ટકા હિસ્સો આપ્યો હતો, જે તેના અગાઉના વર્ષના લગભગ ૬૪ ટકાના હિસ્સા કરતાં ઘટેલો છે. અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે આ પ્રકારની નિર્ભરતાને માત્ર આયાત પર પ્રતિબંધ મૂકીને ઉકેલી શકાય નહીં, કારણ કે તકાવત ફિનિશ પ્રોડક્ટ્સને બદલે અપસ્ટ્રીમ કોમ્પોનન્ટ્સમાં છે. રિપોર્ટ જણાવે છે કે, “જ્યાં સુધી ભારતીય એસેમ્બલી લાઈન્સમાં વપરાતા કોમ્પોનન્ટ્સ લગભગ સંપૂર્ણપણે ચીનથી આવતા રહેશે, ત્યાં સુધી સ્થાનિક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ગમે તેવો કોથ થાય તો પણ આ ચેપ્ટરમાં વેપાર ખાધ માળખાકીય રીતે જળવાઈ રહેશે.” તેના બદલે, રિપોર્ટ સલાહ આપે છે કે નીતિગત સ્તરે અપસ્ટ્રીમ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગના સ્થાનીયકરણને પ્રાથમિકતા આપવી જોઈએ. આ પ્રાયોગને ભારતની ‘ક્રિટિકલ-મિનરલ્સ સ્ટ્રેટેજી’નું સમર્થન મળવું જોઈએ અને જે ક્ષેત્રોમાં સ્થાનિક વિકલ્પો અશક્ય હોય, ત્યાં ચીની ઉત્પાદકોને ભારતમાં આવી લેવાનું કરવા માટે પસંદગીના ધોરણે મંજૂરી આપતું નિયંત્રિત માળખું બનાવવું જોઈએ. અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, “અંતિમ ઉદ્દેશ્ય સતત આયાત નિર્ભરતાથી હટીને સ્થાનિક રીતે મજબૂત ઉત્પાદન ક્ષમતા તરફ આગળ વધવાનો હોવો જોઈએ.”

કરન્ટ-રોપિક

ડિજિટલ ટોકનમાં રૂપાંતરિત કરે છે, જેને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. પરંતુ એસેટનું ડિજિટાઈઝેશન એ ટ્રાન્ઝેક્શનનો માત્ર એક ભાગ ઉકેલે છે. તેની સામેનું પેમેન્ટ પણ તે જ સમયે અને સુરક્ષિત રીતે થવું જરૂરી છે. સીતારમણે જણાવ્યું, “વિશ્વભરમાં પરીક્ષણ કરવામાં આવી રહેલું દરેક ટોકનાઈઝેશન આર્કિટેક્ચર આખરે એક મૂળભૂત પ્રશ્ન પર પાછું આવે છે: પેમેન્ટ લેયર શું બનેલું છે?” અહીં જ ડિજિટલ રૂપિયો મોટી ભૂમિકા ભજવી શકે છે. ભારતની સરકારી પાવર ફાયનાન્સ કંપની RECએતાજેતરમાં સિક્યોરિટીઝ એન્ડ સેક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના રેગ્યુલેટરી સેન્ડબોક્સ હેઠળ ભારતનો પહેલો ટોકનાઈઝડ કોર્પોરેટ બોન્ડ પાયલોટ પૂર્ણ કર્યો છે. આ વ્યવહારમાં, ટોકનાઈઝડ બોન્ડ અને ડિજિટલ રૂપિયાની એકસાથે આપ-લે કરવામાં આવી હતી, જેનાથી એસેટ અને પેમેન્ટ બંનેનું સેટલમેન્ટ એકસાથે શક્ય બન્યું. “CBDCની હાજરીને કારણે આ નાણાકીય સેટલમેન્ટ શક્ય બન્યું છે. તે બે નિયામકો, RBI અને SEBI વચ્ચેનો તાલમેલ પણ દર્શાવે છે,” સીતારમણે કહ્યું. આવા

કરન્ટ-રોપિક

સીતારમણે કહ્યું કે AI દ્વારા સંચાલિત ઓટોનોમસ સાયબર અવલોકન કદાચ તેમને નિયંત્રિત કરવા માટે વિકસાવવામાં આવી રહેલી સુરક્ષા પ્રણાલીઓ કરતાં વધુ સફળતા મળવું છે. “એક અગ્રણી લેબનું માનવું છે કે ઓટોનોમસ સાયબર ક્ષમતા તેની હાલની નિયંત્રણ પ્રક્રિયાઓ કરતાં વધુ ઝડપથી આગળ વધી રહી છે.” તેમણે ઉમેર્યું કે હાલના પેદાશોમાં ઈન્ટરઓપરેબલ ધોરણો કામ કરે છે. તે કોડ કરનારાઓ અને જરૂરિયાતોને સમજવામાં મદદ કરી શકે છે.

ભારતની સરકારી પાવર ફાયનાન્સ કંપની RECએતાજેતરમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના રેગ્યુલેટરી સેન્ડબોક્સ હેઠળ ભારતનો પહેલો ટોકનાઈઝડ કોર્પોરેટ બોન્ડ પાયલોટ પૂર્ણ કર્યો છે. આ વ્યવહારમાં, ટોકનાઈઝડ બોન્ડ અને ડિજિટલ રૂપિયાની એકસાથે આપ-લે કરવામાં આવી હતી, જેનાથી એસેટ અને પેમેન્ટ બંનેનું સેટલમેન્ટ એકસાથે શક્ય બન્યું

અને અનાવશ્યક મધ્યસ્થીઓને દૂર કરી શકે છે, પરંતુ ભૂલો, છેતરપિંડી અને બજારના આંકડા પણ નાણાકીય પ્રણાલીઓમાં વધુ ઝડપે ફેલાઈ શકે છે. તેમની આ ટિપ્પણીઓ ફાર્માસ અને સાયબર સુરક્ષામાં આર્ટિફિશિયલ આ ક્ષેત્રને મજબૂત સામૂહિક અવાજ આપી શકે છે. “તેથી સમગ્ર ભારતીય ટેકનોલોજી ઈકોસિસ્ટમને એકસાથે લાવતા ફેરરેટેડ ઈન્ડસ્ટ્રી પ્લેટફોર્મ પર વિચાર કરવા યોગ્ય હોઈ શકે છે. આ અલગ-અલગ સમુદાયો વતી બોલવા માટે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ક્ષેત્રને એક વિશ્વાસપાત્ર સામૂહિક અવાજ આપવા માટે હશે,” સીતારમણે કહ્યું. તેમણે ઉમેર્યું હતું કે પાયબર ક્ષમતા તેની હાલની નિયંત્રણ પ્રક્રિયાઓ કરતાં વધુ ઝડપથી આગળ વધી રહી છે.” તેમણે ઉમેર્યું કે હાલના પેદાશોમાં ઈન્ટરઓપરેબલ ધોરણો કામ કરે છે. તે કોડ કરનારાઓ અને જરૂરિયાતોને સમજવામાં મદદ કરી શકે છે.

જ્યારે વિવિધ દેશો AI, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સુરક્ષા અને અન્ય ઉભરીતા ટેકનોલોજીઓની લેતા નિયમો વિકસાવી રહ્યા છે, ત્યારે આવું પ્લેટફોર્મ વિદેશી સરકારો અને નિયામકો સાથેની વાટાઘાટોમાં આ ક્ષેત્રને મજબૂત સામૂહિક અવાજ આપી શકે છે. “તેથી સમગ્ર ભારતીય ટેકનોલોજી ઈકોસિસ્ટમને એકસાથે લાવતા ફેરરેટેડ ઈન્ડસ્ટ્રી પ્લેટફોર્મ પર વિચાર કરવા યોગ્ય હોઈ શકે છે. આ અલગ-અલગ સમુદાયો વતી બોલવા માટે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ક્ષેત્રને એક વિશ્વાસપાત્ર સામૂહિક અવાજ આપવા માટે હશે,” સીતારમણે કહ્યું. તેમણે ઉમેર્યું હતું કે પાયબર ક્ષમતા તેની હાલની નિયંત્રણ પ્રક્રિયાઓ કરતાં વધુ ઝડપથી આગળ વધી રહી છે.” તેમણે ઉમેર્યું કે હાલના પેદાશોમાં ઈન્ટરઓપરેબલ ધોરણો કામ કરે છે. તે કોડ કરનારાઓ અને જરૂરિયાતોને સમજવામાં મદદ કરી શકે છે.